

જંક ફૂડ ખાવાથી શરીર
રોગિષ્ટ બને છે. જંક ફૂડ ખીટલી
વાસી ખીષ્ટકતા આહાર ખોરાક



Consumption of Junk Food makes our body disease prone

Gift milk
દૂધ પીવાથી શરીર
લંદુરસ્ત રહે છે.



દૂધ સંપૂર્ણ સમતોલ
આહાર છે.

Milk is a wholesome- balanced diet. It keeps our body healthy